

Minister of State for External Affairs Smt. Meenakshi Lekhi's visit to Serbia (10-13 October, 2021)

October 14, 2021

રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીની સર્બિયા યાત્રા (10-13 ઓક્ટોબર, 2021)

ઓક્ટોબર 14, 2021

વિદેશ અને સાંસ્કૃતિક બાબતોના રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ 11-12 ઓક્ટોબર, 2021ના રોજ બેલગ્રેડ ખાતે યોજાયેલી બિન-જોડાણવાદી ચળવળની 60મી વર્ષગાંઠ નિમિત્તે ઉચ્ચ સ્તરીય સ્મારક બેઠકમાં પ્રધાનમંત્રીના વિશેષ દૂત તરીકે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું.

2. પરિપટના મુખ્ય સત્રમાં પોતાના સંબોધનમાં, રાજ્યકક્ષાના મંત્રીએ એનએએમના સભ્યોને વૈશ્વિક પરિણામો પર એનએએમની સતત સુસંગતતા અને પ્રભાવને સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. તેમણે એનએએમની મુખ્ય સમકાલીન સમસ્યાઓ જેવા કે આબોહવા પરિવર્તન, આતંકવાદ અને કોવિડ 19 રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં, રાજ્યકક્ષાના મંત્રીએ 93 દેશોમાં 70 મિલિયનથી વધુ રસીઓના પુરવઠા દ્વારા ભારતના યોગદાનને હાઈલાઈટ કર્યું હતું જે વૈશ્વિક જરૂરિયાતોને પહોંચી વળવા તેની સતત પ્રતિબદ્ધતાના અભિવ્યક્તિ તરીકે છે.

3. ઉચ્ચ સ્તરીય એનએએમ બેઠકની સાથે સાથે, રાજ્યકક્ષાના મંત્રીએ યુગાન્ડાના વિદેશ મંત્રી જનરલ જેજે ઓડોંગો સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી અને 2023થી યુગાન્ડાની આગામી અધ્યક્ષતા હેઠળ એનએએમને વધુ મજબૂત અને પુનર્જીવિત કરવાની રીતો પર ચર્ચા કરી હતી.

4. પોતાની મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રીએ સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક અને સર્બિયાના વડાપ્રધાન એના બર્નાબિક સાથે વાતચીત કરી હતી. તેમણે નાયબ વડાપ્રધાન અને કૃષિ, વન, વોટર મેનેજમેન્ટ મંત્રી બ્રેનિસ્લેવ નેડિમોવિક, નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી નેબોન્સા સ્ટેકનોવિક, નાયબ વડાપ્રધાન અને સંસ્કૃતિ અને માહિતી મંત્રી માજા ગોજ્કોવિક, વ્યાપાર, ટુરિઝમ અને ટેલિકોમ મંત્રી તાત્યાના મેટિક, વિદેશ બાબતોના મંત્રી નિકોલા સેલાકોવિક સાથેની અલગ બેઠકોમાં આપણા દ્વિપક્ષીય જોડાણના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન, બંને પક્ષોએ સંબંધોને ઉચ્ચ સ્તરે લઈ જવાની તેમની સહિયારી ઈચ્છાને પુનરાવર્તિત કરી હતી. મુલાકાત દરમિયાન ભારત અને સર્બિયા વચ્ચે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

5. સર્બિયાના પ્રથમ મહિલા મહામહિમ સુશ્રી તમરા વુશિયા સર્બિયન યોગ શિક્ષકો અને પ્રેક્ટિશનરો સાથે યોગ માસ્ટર ક્લાસમાં રાજ્યકક્ષાના મંત્રી સાથે જોડાયા હતા.

6. રાજ્યકક્ષાના મંત્રીએ બેલ્ગ્રેડ યુનિવર્સિટી ઓફ લો ફેકલ્ટીમાં શિક્ષણ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે લંચ મીટિંગમાં ઈન્ડોલોજિસ્ટ્રસ અને ઈન્ડોફાઈલ્સના પસંદગીના જૂથ સાથે વાતચીત પણ કરી હતી.

7. રાજ્યકક્ષાના મંત્રીએ એક ઐતિહાસિક સાંસ્કૃતિક સંસ્થા મેટિકા શ્રીપસ્કાની મુલાકાત લીધી, જ્યાં તેમને પ્રાચીન ભારતીય ગ્રંથોના સર્બિયન અનુવાદો ભેટ આપવામાં આવ્યા હતા.

8. રાજ્યમંત્રીએ મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના સન્માનમાં બાંધવામાં આવેલા સ્મારકો પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

9. આ મુલાકાતથી ભારત અને સર્બિયા વચ્ચેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ વેગ મળ્યો છે. બંને પક્ષો બંને દેશો વચ્ચે ભાગીદારીના વિસ્તરણ અને વૈવિધ્યકરણ માટે સંમત થયા હતા.

નવી દિલ્હી

ઓક્ટોબર 14, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.